

# PERMANENT MAGNETS LIMITED



B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401104. Maharashtra, India

Phone : +91-22-6216 5400 - 10 Facimile : +91-22-2945 2128 Email : sales@pmlindia.com Website : www.pmlindia.com

October 30, 2018

To,  
Corporate Relation Department  
The Bombay Stock Exchange Limited  
Phiroze Jeejeebhoy Tower,  
Dalal Street, Mumbai - 400 001

Dear Sir(s),

**Sub: Intimation regarding Publication of Board Meeting Notice**

**Scrip Code : 504132**

Pursuant to Regulation 47 (3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company attached herewith a Notice to the Shareholders that has been published in the Financial Express (English Daily Newspaper) and Damanganga Times (Gujarati Daily Newspaper) on October 30, 2018 regarding Board Meeting held on Monday, November 12, 2018 to consider and approve Unaudited Financial Results of the Company for the quarter and half year ended as on September 30, 2018.

Further as required under Regulation 46 (2) the said notice have also been placed on Company's Website at [www.pmlindia.com](http://www.pmlindia.com) and the Shareholders may refer to the same for details.

We request you to kindly take the same on record.

Thanking you,

Yours Faithfully,

**FOR PERMANENT MAGNETS LIMITED**

**RACHANA RANE  
COMPANY SECRETARY**



Regd Office: Harsh Avenue, 302, 3<sup>rd</sup> Floor, opp. Silvassa Police Station, Silvassa Vapi Main Road,  
Silvassa- 396 230. Dadra and Nagar Haveli (U.T.)

*(All correspondence has to be made at our Mira Road address only)*

CIN-L27100DN1960PLC000371







# China weighs stimulus as auto sales drop

BLOOMBERG  
Beijing, October 29

CHINA IS CONSIDERING a tax cut to revive its flagging automotive market, according to people familiar with the matter, lending support to a key industry that's been damaged by an ongoing trade war with the US.

Carmakers surged after Bloomberg News reported the potential move, which would stimulate a market they've increasingly relied on for growth. Volkswagen, selling just under 40% of its vehicles in China last year, rose as much as 6.9%, the biggest intraday move since July 2016. Ford Motor and General Motors rallied in pre-market US trading, while BMW and Daimler

gained in Germany. An incentive would help shore up the world's largest automotive market, which is facing its first decline in more than two decades as a trade war with the US hits at consumer spending power. A torrid few months of escalating countermeasures have led Volkswagen, Ford and Renault to all cut their outlooks, as sales in the country slid for four straight months. Tensions with the US have started to ripple more broadly through China's economy and its stock market, showing a more direct impact than on the US.

To counteract the slow-down, China's top economic planning body is proposing to halve the tax on car purchases to 5%.

# Labour unrest at ZF Steering, commissioner calls meeting

GEETA NAIR  
Pune, October 29

FOLLOWING LABOUR TROUBLE that erupted at automotive component firm ZF Steering Gear (India) in Pune, Pune Labour Commissioner on Monday called upon its management for a meeting to resolve the issue.

ZF, in an official statement, said they had terminated the services of 236 employees and dismissed them with effect from October 26 and 27. The company claimed that the workers were terminated because of "acts of misconduct on their part". ZF is major supplier of steering systems to virtually all the big names in the automotive business especially commercial vehicle OEMs. Among them are Tata Motors, Ashok Leyland, Volvo Eicher, Daimler India Commercial Vehicles, Volvo, Force Motors, Mahindra, Swaraj Mazda,

Escorts and IITL. ZF said charge sheets were filed against 236 them on February 6 followed by enquiry into the charges leveled and the employees were found to be guilty of the charges, which included remaining absent continuously for more than 47 days without permission and sufficient cause, the company said. The company claimed to have taken the decision after several rounds of discussion with employees failed to reach any conclusion.

ZF Steering is promoted by Dinesh Munot family, which hold around 48% with Robert Bosch Automotive Steering GmbH holding 26% in the company. ZF Steering supplies power steering and mechanical steering systems for HCV, LCV, MUV, SUV, passenger cars and tractors to OEMs. ZF has its plant at Vadu Budruk on Pune-Ahmednagar Highway.

**Public Caution Notice**

This is with reference to one of current account with Bank of Maharashtra, Karvenagar Branch, Pune. The account was closed on 11/01/2017. A Cheque Book having Cheque No. from 12766 to 12825 is found missing. Public at large are hereby advised and cautioned not to deal with the said Cheque Series, the Bank will not be responsible for any consequences.

Branch Manager

**सेन्ट्रल बँक ऑफ इंडिया**  
सेन्ट्रल बँक ऑफ इंडिया  
Central Bank of India

Sagrampura Branch : Above Sitaram Temple, Sagrampura, Surat - 395002. Ph. 0261-2354745/2331545

**POSSESSION NOTICE**  
APPENDIX IV [See Rule 8(1)] (For immovable property)

Whereas, The undersigned being the Authorised Officer of Central Bank of India, Sagrampura Branch, Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 06/08/2018 calling upon Mr. Rakeshbhai Nazabhai Khuman & Kishorabhai Nazabhai Khuman to repay the amount mentioned in the notice being Rs. 21,08,146/- (Rupees Twenty One Lac Eight Thousand One Hundred Forty Six Only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower/ Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic possession** of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said (Act) read with rule 8 & 9 of the said Rules on this 26<sup>th</sup> day of October of the year 2018

The Borrower/ Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, Sagrampura Branch, Surat for an amount being Rs. 21,08,146/- (Rupees Twenty One Lac Eight Thousand One Hundred Forty Six Only) due as on 06/08/2018 and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All That Piece And Parcels Of Immovable Property Bearing At Plot No. 3, Adm. 55.78 Sq.Mtrs. In Shailesh Park Society, Land Bearing R.S.No. 162, Block No. 223, T.P.Scheme No. 27, F.P.No. 105, Lying, Being & Situated At Village: Utran, Sub-District: Choryasi, District: Surat in the name of Rakeshbhai Nazabhai Khuman

Sd/-  
Date : 26.10.2018  
Place : Surat  
Authorised Officer,  
Central Bank of India

**HESTER BIOSCIENCES LIMITED**

Registered Office: 1st Floor, PUSHPAK, Panchwati Circle, Motilal Hirabhai Road, Ahmedabad, Gujarat 380 006, India  
Phone : + 91 79 26445106 Fax: + 91 79 26445105 Email: mail@hester.in Website: www.hester.in  
CIN: L99999GJ1987PLC022333

**STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2018**  
(In Million INR)

Sr. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30.09.2018	30.06.2018	30.09.2017	30.09.2018	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income	428.28	390.33	391.09	818.61	687.02
2	Net Profit for the period before tax and exceptional items	138.40	134.04	140.20	272.45	233.41
3	Net Profit for the period before tax after exceptional items	138.40	134.04	140.20	272.45	233.41
4	Net Profit for the period after tax	99.32	96.84	88.55	196.16	150.44
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period after tax and Other Comprehensive Income after tax)	97.76	97.17	87.15	194.93	148.80
6	Paid-up equity share capital (face value of INR 10 each)	85.07	85.07	85.07	85.07	85.07
7	Reserves and Surplus	-	-	-	-	1,375.71
8	Earnings per share (of INR 10 each) (Not Annualised)					
	(a) Basic:	11.68	11.38	10.41	23.06	17.68
	(b) Diluted:	11.68	11.38	10.41	23.06	17.68

Notes:  
1 The above is an extract of the detailed format of quarterly and half yearly ended Financial Results submitted with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly and half ended Financial Results are available on the Stock Exchange websites. (www.nseindia.com & www.bseindia.com) and on the Company's website (www.hester.in).  
2 The Board of Directors have declared 2nd Interim Dividend of INR 2 per equity share (20%) for the financial year 2018-19.

For and on behalf of the Board of Directors  
Rajiv Gandhi  
CEO & Managing Director

Place : Ahmedabad  
Date : 29 October 2018

**BHAIRAV ENTERPRISES LTD.**  
CIN: L51909MH1984PLC217692  
Warden House, 340, J.J. Road, Byculla, Mumbai 400 008.  
TEL: (91) 22 2302 7900 FAX: (91) 22 2307 7231  
Website: www.bhairaventerprises.com  
Email: cosec@bhairaventerprises.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements), Regulations, 2015 NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, 14th November, 2018**, at the registered office of the Company at Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the 2nd quarter ended 30th September, 2018.

The said information is also available on the Company's website at [www.bhairaventerprises.com](http://www.bhairaventerprises.com) under Investors Relation section and also available on the website of the Stock Exchange at [www.mse.in](http://www.mse.in).

For BHAIRAV ENTERPRISES LTD.  
Sd/-  
Sunil Y. Surve  
Director  
Place : Mumbai  
Date : 29.10.2018  
Din : 00065166

**ABHINANDAN ENTERPRISES LTD.**  
CIN: L17199MH1984PLC217684  
Warden House, 340, J.J. Road, Byculla, Mumbai - 400 008.  
TEL: (91) 22 2302 7900 FAX: (91) 22 2307 7231  
Website: www.abhinandanenterprisesltd.com  
Email: cosec@abhinandanenterprisesltd.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements), Regulations, 2015 NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, 14th November, 2018**, at the registered office of the Company at Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the 2nd quarter ended 30th September, 2018.

The said information is also available on the Company's website at [www.abhinandanenterprisesltd.com](http://www.abhinandanenterprisesltd.com) under Investors Relation section and also available on the website of the Stock Exchange at [www.mse.in](http://www.mse.in).

For ABHINANDAN ENTERPRISES LTD.  
Sd/-  
Sunil Y. Surve  
Director  
Place : Mumbai  
Date : 29.10.2018  
Din : 00065166

**MRUGESH TRADING LIMITED**  
CIN: L74999MH1984PLC034746  
Warden House, 340, J.J. Road, Byculla, Mumbai - 400 008.  
TEL: (91) 22 2302 7900 FAX: (91) 22 2307 7231  
Website: www.mrugeshtrading.com  
Email: cosec@mrugeshtrading.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements), Regulations, 2015 NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, 14th November, 2018**, at the registered office of the Company at Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the 2nd quarter ended 30th September, 2018.

The said information is also available on the Company's website at [www.mrugeshtrading.com](http://www.mrugeshtrading.com) under Investors Relation section and also available on the website of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).

For MRUGESH TRADING LIMITED  
Sd/-  
Sunil Y. Surve  
Director  
Place : Mumbai  
Date : 29.10.2018  
Din : 00065166

**PERMANENT MAGNETS LIMITED**  
Regd. Off: Herath Avenue, 302-303, 3rd Fl., Opp. Silvassa Police Station, Silvassa Vap, Main Road, Silvassa - 396230, Dadra and Nagar Haveli (U.T.)  
CIN: L27190DN1960PLC000371  
Website: www.pmlindia.com  
Email ID: investors@pmlindia.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Monday, November 12, 2018 at B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401104 inter alia to consider, approve and take on record the Unaudited Financial Results for the quarter and half year ended as on September 30, 2018.

The said Notice can be accessed on the company's website at [www.pmlindia.com](http://www.pmlindia.com) and on the BSE Limited's website at [www.bseindia.com](http://www.bseindia.com).

Pursuant to Regulation 9 read with Schedule B to the Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015 and the company as per its code of conduct, has decided that the close period (i.e. closure of trading window) shall commence from November 05, 2018 and end on November 15, 2018 (both days inclusive).

For Permanent Magnets Ltd  
Sd/-  
(Rachana Rane)  
Company Secretary  
Date: 30-10-2018  
Place: Mira Road

**AXON VENTURES LIMITED**  
(Formerly Axon Finance Limited)  
CIN: L65999MH1982PLC027945  
Regd. Off: Shop No. 26, Meera CHS, New Link Road, Nr. Oshiwara Police Station, Andheri (W), Mumbai-53  
Tel No: 9152096142  
Email id: axoninfotechltd@gmail.com  
Website: www.axoninfotech.in

**NOTICE**  
Notice is hereby given that pursuant to Regulation 29 (1) (a) read with 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation 2015, a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, 05<sup>th</sup> November, 2018 at 11:00 A.M., inter-alia to consider and approve Unaudited Financial Results for the quarter ended 30<sup>th</sup> September, 2018 along with Limited Review Report thereon and other businesses.

This information is available on the website of the Company at [www.axoninfotech.in](http://www.axoninfotech.in) as well as on the website of the Bombay Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).

For AXON VENTURES LIMITED  
Sd/-  
Girraj Kishor Agrawal  
Director  
Place : Mumbai  
Date : 29/10/2018  
DIN: 00290959

**SHRI GURUDEV EN-TRADE LTD.**  
CIN: L29224MH1984PLC217693  
Warden House, 340, J.J. Road, Byculla, Mumbai 400 008.  
TEL: (91) 22 2302 7900 FAX: (91) 22 2307 7231  
Website: www.shrigurudevtrade.com  
Email: cosec@shrigurudevtrade.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements), Regulations, 2015 NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, 14th November, 2018**, at the registered office of the Company at Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the 2nd quarter ended 30th September, 2018.

The said information is also available on the Company's website at [www.shrigurudevtrade.com](http://www.shrigurudevtrade.com) under Investors Relation section and also available on the website of the Stock Exchange at [www.mse.in](http://www.mse.in).

For SHRI GURUDEV EN-TRADE LTD.  
Sd/-  
Sunil Y. Surve  
Director  
Place : Mumbai  
Date : 29.10.2018  
Din : 00065166

**LYNX MACHINERY AND COMMERCIALS LTD.**  
CIN: L29299MH1960PLC011870  
Regd. Office: Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008  
Tel: 022-23027900 Fax: (91) 22 2307 7231  
Website: www.lynxmachinery.com  
Email: cosec@lynxmachinery.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements), Regulations, 2015 NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Tuesday, 6th November, 2018**, at the registered office of the Company at Warden House, 340 J.J. Road, Byculla, Mumbai 400008, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the 2nd quarter ended 30th September, 2018.

The said information is also available on the Company's website at [www.lynxmachinery.com](http://www.lynxmachinery.com) under Investors Relation section and also available on the website of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).

For Lynx Machinery And Commercials Ltd.  
Sd/-  
H.K. Jajodia  
Director  
Place : Mumbai  
Date : 29.10.2018  
(DIN: 00075508)

**NHC FOODS LIMITED**  
Regd. Off: Survey No. 777, Umarsadi Desaiwadi Road, at Village Umarsadi, Taluka Pardi, Killa Pardi, Gujarat - 396175.  
Website: www.nhcgroup.com  
Tel. No.: 022-48815100 Fax No. 48815101  
Email id: grievances@nhcgroup.com  
CIN: L15122GJ1992PLC076277

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, 13th November, 2018 at its Corporate Office at D-22/8, TTC Industrial Area, MIDC, Turbhe, Navi Mumbai - 400705 to consider and approve, inter alia, the Unaudited Financial Results for the Second Quarter and Half Year Ended 30th September, 2018. Further, pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 and as per the Company's Code of Conduct for Prevention of Insider Trading, the window for trading in the shares of the Company shall remain closed from 29th October, 2018 till 48 hours after the results are made public on 13th November, 2018 for Directors, KMP officers and Designated Employees and their immediate relatives.

The information contained in the notice is also available on the website of the Company at [www.nhcgroup.com](http://www.nhcgroup.com) and also website of BSE i.e. [www.bseindia.com](http://www.bseindia.com).

By order of the Board  
For and behalf of NHC Foods Ltd.  
Sd/-  
Krina Mehta  
(Company Secretary)  
Date : 29.10.2018  
Place : Navi Mumbai  
Compliance Officer

**ATLANTIC COMMERCIAL COMPANY LIMITED**  
Regd Office: 605, 6<sup>th</sup> Floor, Vikrant Tower, 4, Ragnendra Place, Near Delhi - 110008  
CIN: L51909DL1985PLC020372  
E-mail id: limitedatlantic@gmail.com  
Website: www.atlantic-commercial.com  
Ph: 011-41539140, Fax: 011-25765214

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, November 13, 2018, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the second quarter and half year ended September 30, 2018.

The information contained in this notice may be accessed on the Company's website at [www.atlantic-commercial.com](http://www.atlantic-commercial.com) and also on the website of the stock exchange i.e. [www.mse.in](http://www.mse.in).

For Atlantic Commercial Company Limited  
Sd/-  
Narendra Kishore Gaur  
Chairman  
Date: 29.10.2018  
DIN : 00168285

**TAINWALA CHEMICALS AND PLASTICS (INDIA) LIMITED**  
Registered office: "Tainwala House", Road No.18, M.I.D.C., Andheri (East), Mumbai-400 093  
CIN NO.: L24100MH1985PLC037387

**NOTICE**  
Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on **Monday, 05<sup>th</sup> November, 2018 at 2.00 P.M.** at the registered office of the Company to inter-alia, consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the Quarter and Half Year ended on 30<sup>th</sup> September, 2018 and any other business.

This information is also available on the Company's website i.e. [www.tainwala.in](http://www.tainwala.in) and on the stock exchange websites i.e. [www.bseindia.com](http://www.bseindia.com) & [www.nseindia.com](http://www.nseindia.com).

For Tainwala Chemicals and Plastics (India) Limited  
Sd/-  
Rajkumar Tainwala  
Place : Mumbai  
Date : 29/10/2018 (DIN No.: 00294029)

**Landmark Property Development Company Limited**  
Registered Office: 11th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi- 110001  
CIN: L13100DL1976PLC188942  
T. No. 91 11 43621200,  
Fax No. 91 11 41501333  
Email: info@landmarkproperty.in  
Web Site: www.landmarkproperty.in

**Postponement of date of Board Meeting for approval of Unaudited Financial Results for the quarter ended 30.09.2018**

Pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company (scheduled to be held on October 30, 2018) is now postponed to be held on November 5, 2018, inter-alia, to approve unaudited Financial Results of the Company for the quarter ended September 30, 2018.

This information is also available on the web site of the Company and the web sites of the Stock Exchanges (where the Company's shares are listed viz. [www.bseindia.com](http://www.bseindia.com)) and [www.nseindia.com](http://www.nseindia.com))

For Landmark Property Development Company Limited  
Sd/-  
S.K.Chawla  
Company Secretary  
Place: New Delhi  
Date: 29.10.2018

**IDBI BANK**  
IDBI Bank Ltd  
Retail Recovery, 3<sup>rd</sup> Floor, Dnyaneshwar Paduka Chowk, F.C.Road, Shivaji Nagar, Pune - 411 004  
CIN No: L65190MH2004GO148838

**POSSESSION NOTICE**

The Authorized Office of IDBI Bank Ltd., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (the Act), and in exercise of the powers conferred under Section 13(2) read with Security Interest (Enforcement) Rules, 2002, (the Rules), issued a demand notice under Section 13 (2) to borrower, as listed below, calling upon the borrower to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower mentioned below having failed to repay the said amount, the notice is hereby given to the borrower mentioned below and the public in general that the Authorized Officer has taken Symbolic Possession of the property mortgaged, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002, on the Dates of possession mentioned below against name of borrower as detailed below. The borrower in particulars and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the change of the IDBI Bank Ltd., Against the names of borrower for an amount mentioned below and interest and charges thereon. The borrower attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr No	Name of the Borrowers / Property Holders and Loan account No	Date of Demand Notice	Date of Possession	Description of immovable property	Outstanding Amount (₹) as on date
1	Pramod Baban Mule and Mrs. Shakuntala Baban Mule and Lan No:102675100003261	04-08-18	25-10-2018 (Symbolic)	Flat No-D-105, Mantra Majestica, S. No. 42 A, Sasane Nagar, Kalepadal Road, Hadapsar, Pune - 411 028	₹ 11,19,998/- as on 10-07-2018. Plus further interest, cost, charges etc. incurred or to be incurred thereafter.

Place: Pune  
Date: 30/10/2018  
Sd/-  
Authorised Officer

**कुम्भ मेला 2019**  
**कार्यालय प्रयागराज मेला प्राधिकरण, प्रयागराज।**  
त्रिवेणी भवन, वेणी बाँध, दारमज, प्रयागराज।  
ऑफिस-0532-2504011, फैक्स-0532-2500775

**ई-निविदा Request for Proposal (RFP) for allotment of shops in Meena Bazaar in Sector 2 of the Mela area for Kumbh Mela, 2019 आमन्त्रण सूचना**  
प्रयागराज मेला प्राधिकरण क्षेत्र में वित्तीय वर्ष 2018-19 हेतु मीना बाजार की दुकानों के आवंटन हेतु निविदा संख्या-39 Request for Proposal (RFP) for allotment of shops in Meena Bazaar in Sector 2 of the Mela area for Kumbh Mela, 2019 आमन्त्रण सूचना  
आनलाईन निविदाएं उत्तर प्रदेश की ई-प्रोक्वोरमेंट की वेबसाइट <http://etender.up.nic.in> के माध्यम से आमन्त्रित की जाती है। उपरोक्त निविदा से सम्बन्धित अभिलेख वेबसाइट पर उपलब्ध है, जिन्हें दिनांक 29.10.2018 से 19.11.2018 को माध्यम 14.00 बजे तक डाउनलोड/अपलोड डिजिटल सिग्नेचर सर्टिफिकेट (DSC) के द्वारा किया जा सकता है। आनलाईन प्राप्त निविदा दिनांक 19.11.2018 को अपराह्न 16.00 बजे उपस्थित निविदादाताओं के समक्ष खोली जाएगी। निविदा के सम्बन्ध में विस्तृत जानकारी तथा शर्तें वेबसाइट <http://etender.up.nic.in> पर देखी जा सकती है।

मेलधिकारी,  
कुम्भ मेला, प्रयागराज।

**Latur Urban Co-op Bank Ltd Latur**  
Pune Div. - Late. Ramgopalji Rathi Commercial Complex, Shivajinagar, Latur-413531

**FORM "Z" (See sub-rule (11(d-1) of rule 107) POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY**

Whereas the undersigned being the Special Recovery Officer of the The Latur Urban Co-op. Bank Ltd., Latur, under the Maharashtra Co-operative Societies Rules, 1961 issued a demand notice dated 01/09/2018 calling upon the judgement debtor.

**Shri. Kalbhor Laxmikant Balasaheb** to repay the amount mentioned in the notice being Rs. 12,97,962/- (In words — Twelve Lakh Ninety Seven Thousand Nine Hundred sixty Two Only) with date of receipt of the said notice and the judgement debtor having failed to repay the amount, the undersigned has issued a notice for attachment dated 29/09/2018 and attached the property described herein below.

The judgement debtor having failed to repay the amount, notice is hereby given to the judgement debtor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under rule 107(11(d-1) of Maharashtra Co-operative Societies Rules, 1961 on this day of 29 Sept. of the year 2018.

The judgement debtor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the The Latur Urban Co-op. Bank Ltd., Latur, for an amount Rs. 14,32,854/- and further interest plus charges thereon.

**Description of the Immovable Property - Name of the Owner - Shri. Dalvi Uttam Namdev - Gat No. 131, Area 00 H.58.07 R. Boundary Bounded by - East - Property of Mr. Sunil Badhe, West - Property of Mr. Namdeo Dalvi, South -By Road, North - Adjoining Property.**

Date : 24/10/2018  
Place : Pune  
Sd/-  
D. K. Gavali, Special Recovery Officer  
The Latur Urban Co-Op. Bank Ltd., Latur

facebook presents **ie thinc**

**Understanding how fake news can impact the course of elections.**

Will India's crisis of fake news worsen as it enters an election year? Will fake news sway opinions and change electoral fortunes? In this edition of IE Thinc, political and media analysts and those in the business of news, discuss the issue as the world's largest democracy prepares for Elections 2019.

Fireside Chat with Nasim Zaidi, Former Chief Election Commissioner

**PANELISTS INCLUDE:**

Ashutosh Former TV journalist and former AAP leader	Chandra Mani Shukla Executive Council Member IPAC	Jency Jacob Managing Editor Boom
Tom Goldstein Founding Dean and Professor Jindal School of Journalism and Communication	Sudha Pai Political Scientist	

Entry by invite only.

**31 OCT 2018** **06:00 PM** **NEW DELHI**

**The Indian EXPRESS**  
JOURNALISM OF COURAGE

Ahmedabad